

છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે શહેરમાં જય શિવરાયા ટ્રસ્ટ દ્વારા ભવ્ય વાહન રેલીનું આયોજન કરાયું



છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે શનિવારે જય શિવરાયા ટ્રસ્ટ તરફથી વાહન રેલીનું આયોજન કરાયું હતું. સવારવાડામાં આવેલી શિવાજીની પ્રતિમાને ફૂલહાર કરીને માણ મેયર રણજીત ચવાણે રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીમાં છત્રપતિ મહારાજના ફોટો સાથે રપ૦ વાહનો જોડાયા હતા. રેલીમાં ભાગ લેનારે કેસરી ધ્વજ અને કેસરી સાફા બાંધતા વાતાવરણ કેસરી રંગે રંગાયું હતું. આ રેલીમાં દશ હજાર ઉપરાંત લોકો જોડાયા હતા. જય ભવાની જય શિવાજીના નાદથી રાજમાર્ગો ગાળી ઉઠ્યા હતા. રેલી કોઠી ચાર રસ્તા, અમદાવાદી પોળ, ગાંધીનગરગૃહ, લહેરીપુરા, નવાપુરા રોડ, બરાણપુરા ખાતે પહોંચી હતી. જ્યાં છત્રપતિની પ્રતિમાને ફૂલહાર કરીને રેલીનું વિસર્જન કરાયું હતું.

મુજમહૂડામાં હયાત શિવાજી મહારાજની પ્રતિમાને સ્થાને શિવાજી મહારાજની અશ્વરૂઢ પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે માંજલપુરમાં છત્રપતિ શિવાજી મહારાજ માર્ગ નામ આપવા માગ

મહારાષ્ટ્રીય સમાજ માટે ખુશીના સમાચાર છે. મુજમહૂડા ખાતે હયાત શિવાજી મહારાજની પ્રતિમાને સ્થાને નવી અશ્વરૂઢ પ્રતિમા સ્થાપિત કરાશે. કોર્પોરેશનની બજેટ સભામાં પાછી પુરવઠા સમિતિના ચેરમેન મનિષ પગારે રજૂઆત કરી હતી કે, જે તે સમયે મુજમહૂડા ખાતે શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરાઈ હતી જે સારી પ્રતિમા છે પરંતુ શિવાજી મહારાજ જે રીતે કાર્યો કર્યા અને યુદ્ધ કર્યા તે જોતા એ પ્રતિમા કદ પ્રમાણે યોગ્ય નથી. જેથી મારે મહારાષ્ટ્રીય સમાજના અગ્રણીઓ સાથે ચર્ચા છે અને બધા ત્યાં અમારા બચે હયાત પ્રતિમાના સ્થાને શિવાજી મહારાજની અશ્વ પર સવાર પ્રતિમા સ્થાપિત કરવા માંગીએ છીએ. મેયર કેયુર રોકડિયાએ કહ્યું હતું કે, પ્રતિમા બદલવાની વાત છે જેથી કોઈ વાંધાજનક નથી. સભામાં સૌ તેયાર હોય તો આપણે સંજુરી આપી દઈએ. સૌ કોઈએ હાથ ધર્યો હતો. તરસાલીના ભાજપના કોર્પોરેટર નિલેશ રાઠોડે માંજલપુર સરસ્વતી કોમ્પ્લેક્સથી જીઆઈડીસી અભયનગર તરફના રોડનું નામ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ માર્ગ આપવા માગ કરી હતી.

રિફાઈનરી રોડ પર મકાનના તાળાં તોડી ચોરી કરતાં તસ્કરો

શહેરના રિફાઈનરી રોડ પર આવેલી દર્શનમ વાટીકા સોસાયટીમાં તાટકેલા તસ્કરોએ બે મકાનને નિશાન બનાવી સાફસુફી કરી હતી. જેમાં તસ્કરો વિધવા મહિલાના ઘરમાંથી રૂ. ૧.૮૭ લાખની માલમત્તા લઈ ગયા હતા. જ્યારે આજ સોસાયટીમાં આવેલા અન્ય એક મકાનમાં પણ સાફસુફી કરી હતી, પરંતુ મકાન માલિક અમદાવાદ ગયા હોવાથી કેટલાકની ચોરી થઈ છે? તે જાણી શકાયું ન હતું.

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા
1911 સે કાલેક્ટર ટિલ્ડ "કેન્ટ્રલ" "Central" TO YOU SINCE 1911

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, બુલેટ ભવન ની પાસે, જેલ રોડ, વડોદરા - ૩૬૦૦૦૧.

પરિસર ભાડે રાખવા માટે બિઝનેસ/ઓફિસ આર્થિકતા

ક્રમ	પરિસર/ભાડા	જરૂરી ફાઇન્ટેસિયલ	સામાન/બાઈલેન્સ	નોંધ
૧.	કરન્સી ચેસ્ટ	૩૫૦૦ થી ૪૦૦૦ (બોલ્ટો)	વડોદરા સીટી વીસ્ટાર	પાર્ટીનગી વ્યવસ્થા અલગથી કરી આપવાની રહેશે.

કરન્સી ચેસ્ટ AAA ક્લાસનું જેની સીટીંગ ની ઊંચાઈ બોલ્ટોમાં કોઈ ૧૫ ફુટ હોવી જોઈએ. પરિસર ને પર્સનલ પાર્ટીનગી જગ્યા સાથે પડેશન માટે તૈયાર હોવી જોઈએ. કુપા કરી કોઈ દાવા કે વરોધિયાએ સંપર્ક કરવો નહીં. સરકારી/અર્થ સરકારી સંસ્થા અથવા જાહેર સેન્ટ્રલ સંસ્થા ને પ્રાથમિકતા આપવામાં આવશે. ઓફિસ ને અલગ કોર્ટેજ (ટેલિફોન અને કમ્પ્યુટરનીવલ બીડ) તેમજ બન્ને અલગ કલ્યાણ ઉપર મુજબ દર્શાવીને તે બન્ને કલ્યાણ એક કલ્યાણમાં જમા કરાવવાના રહેશે. કોર્ટેજ/વિવરો અથવા શરતો વેબસાઈટ <http://www.centralbankofindia.co.in> પરથી ડાઉનલોડ કરી શકાશે. અરજી જમા કરાવવાની અંતિમ તારીખ ૨૮-૦૨-૨૦૨૨ સુધી. ૧.૦૦ સોંજના કરન્સી ચેસ્ટ માટે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, પહેલી માળ, સીટી હોટલ ઓફિસ, બીએસએલએલ ભવન, બુલેટ ભવનની પાસે, જેલ રોડ, વડોદરા - ૩૬૦૦૦૧ છે.

નોંધ: ૧) કોર્ટેજના કે તમામ ઓફિસ સ્પીકરવાળી કે રહ કરવાના તમામ અધિકાર યેંક આભાષિત રાખે છે. ૨) રા. ૨૦.૦૨.૨૦૨૨ સુધીના વડોદરા અધિકાર અધિકારી - સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા

હરિશને આપની મદદની જરૂર છે!

આઈડિયલ જિલ્લાના ભાવેજ ગામના ૨૫ વર્ષીય હરિશ મોહિલ રંગમથક કરતાં બાંધકામ પરથી થઈ જતાં તેને કોરોનજીમાં ગંભીર ઈજા થઈ છે. જેની સર્જરી કર્યા બાદ તેની હોસ્પિટલના SICUમાં ભારે દવાઓ અને કીડિયોમેટ્રી સાથે સારવાર ચાલી રહી છે. સારવારનો અંદાજિત ખર્ચ રૂ. ૧,૮૨,૦૦૦ છે. વિધાનું કુળ યુવાવ્ધા બાદ ખેતમજૂરી કરીને નજીવી આવકમાં મુજબન કરતી તેની વિધવા માતા સારવારનો ખર્ચ ઉઠાવી શકે તેમ નથી. હરિશને સાજી કરી હોમમેડ તેના ઘરે પહોંચાડવા, તેની સારવારમાં સહાય કરવા શ્રી કુખ્ય હોસ્પિટલ આપને અપીલ કરે છે.

આપનું મનુષ્યનું "આરુર આરોગ્ય મંથન" ને વેક દ્વારા, નીચે જણાવેલ બેંકમાં ઓનલાઈન અથવા QR કોડથી કરવા વિનંતી. ખાતાનું નામ: આરોગ્ય મંથન બેંક નામ: અક્ષિસ બેંક લિ., વલ્લભ વિધાનગર ખાતા નં: ૬૨૦૦૩૦૦૦૦૮૧૫૩૧૦ IFSC Code: UTIB00000038 જે પાનકાર્ડની વિગતો આપવાથી સંકલન ૮૦ ક્ર હેઠળ આવકવેરામાંથી મુક્તિને પાત્ર બનશે.

ક્રી રેડીયો ગ્રુપ, મેનેજમેન્ટ સેન્ટર, ગોકલનગર, કસમહ ૩૮૮૩૨૫ ફોન: ૦૨૬૮૨-૨૨૮૪૧/૮૧૧ મો. ૮૧૪૧૮ ૩૩૩૨૨ helpus@charutarhealth.org

શ્રી કુખ્ય હોસ્પિટલ

પાર્શ્વ® સેવાશ્રમ હોસ્પિટલ
શુ. લીમડા, તા. વાઘોડિયા, જી. વડોદરા.

૭૫૦ બેડ ધરાવતી મલ્ટીસ્પેશિયલીટી હોસ્પિટલ

કિડની ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર

કિડની ની બીમારી તથા ડાયાલિસીસના દર્દીઓ માટે કિડની પ્રત્યારોપણ વિશેની માહિતી મેળવવા સંપર્ક કરો

અનુભવી અને કુશળ ડોક્ટરો અને પેરામેડિકલ ટીમ 24x7 ઉપલબ્ધ આઈસીયુ | ઓપરેશન થિયેટર | તાત્કાલિક સારવાર

25 બેડ ધરાવતું આધુનિક ડાયાલિસીસ સેન્ટર

૯૦૯૯૯૯૯૦૯૩

TORQUE

TOREX COUGH SYRUP

ALVIDA KHANSI

TOREX COUGH SYRUP

ALVIDA KHANSI

TOREX

COUGH SYRUP છે તો અલવિદા ખાંસી

For more information, please contact : +91 97792 14455, +91 73199 35154 (Whatsapp) / care@torquepharma.com

MANGLA GROUP
40 YEARS OF LEGACY
BEST QUALITY ASSURANCE

Mangla Trade Hub, Nr. Billabong School, Vadsar Ring Road, Vadsar, Vadodara-390010, Gujarat.

It's Vadodara's Futuristic Business Destination

Invest In Prosperous Tomorrow! Book Vadodara's Future Business Destination And Get Incredible Inaugural Benefits With

Minimum 10% Down Payment, Offer Valid Only For 19th And 20th February 2022

HURRY UP...
Grab Your Offer Now !!!

+91 75670 33344

www.manglagroup.in

RERA: PR/GJ/VADODARA/VADODARA/Other/CAA09549/251221